



પર્યુષણ મહાપર્વ



મંગલાચરણ



પરાત્પર ગુરુને હું પ્રણમું, પરંપરાચાર્ય ગુરુને વંદું,
પરમગુરુ શ્રી રાજચંદ્ર નમું!
આતમનો અણસારો જે છે, મુક્તિનો ધ્રુવતારો એ છે,
સાક્ષાત્ પ્રત્યક્ષ ગુરુને નમું!

કેવળ અંતર્મુખ થવાનો, સત્પુરુષોનો માર્ગ ન્યારો,
સર્વ દુઃખક્ષયનો ઉપાય અહો!
મહત્ પુણ્યનો યોગ ફળ્યો, વિશુદ્ધ મતિ સદ્ગુરુજી આપો,
તીવ્ર વૈરાગ્ય હૃદયમાં હો!
સમ્યગ્દર્શનનાં અજવાળાં, હો ચિદાકાશે અનેરાં,
આપજો આશિષ સદ્ગુરુદેવ.

સત્પુરુષનો સમાગમ પામ્યો, ધન્ય અવસર માનવદેહનો,
જીતી લઉં પ્રમાદ આ ભવે;
કેવળ કરુણામૂર્તિ પ્રભુજી, અનુગ્રહ કરી સમજાવો,
વચનામૃતને અનુસરીએ.

આપનો અંબાલાલ બનવું ગમે,
શુદ્ધ ભક્તિ આપજો મને!

MANGALACHARAN



Parātpar Guru ne hu pranamu, paramparāchārya Gurune vandu,
Paramguru Shri Rājchandra namu
Ātam no ansāro je chhe, muktino dhruvtāro ae chhe
Sākshāt pratyaksh Gurune namu!

Keval antarmukh thavāno, Satpurushono mārg nyāro
Sarva dukh kshayno upāy aho!
Mahat punyano yog falyo, vishuddh mati Sadguruji Āpo
Tivra vairāgya hridaymā ho!
Samyagdarshannā ajvālā, ho chidākāshe anerā;
Āpjo āshish Sadgurudev.

Satpurushno samāgam pāmyo, dhanya avsar mānavdehno;
Jeeti lau pramād ā bhavey;
Keval karunāmoorti Prabhuji, anugrah kari samjāvo,
Vachanāmrutne anusarie

Āpno Ambālāl banvu gamey
Shuddh bhakti Āpjo maney!

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
પત્રાંક - ૮૧૬

સર્વદુઃખક્ષય અંતર્બુખતાથી Remedy of All Misery



મનુષ્યદેહરૂપ અવસરમાં પ્રમાદ!
The Opportunity of Human Birth!

મહત્ પુણ્યનો યોગ
Fruition of Great Merit

વિશુદ્ધ મતિ
Pure Intellect

તીવ્ર વૈરાગ્ય
Intense Detachment

સત્પુરુષનો સમાગમ
Association of the Enlightened

સર્વદુઃખક્ષયનો ઉપાય
End of Suffering

અંતર્બુખતાનો માર્ગ
The Path to Go Within

Patrank – 816



Mumbai, Kartak Vad 5, 1954

The letters written by you have been received.

You have expressed an inclination to promote some spiritual texts for the benefit of people, I am aware about it.

Maganlal and others had expressed the desire to see and meet, those letters have also been received.

The path of the enlightened ones to become absolutely soul-focused is the remedy to annihilate all sorrows, but a rare one understands that. That remedy can be understood through the manifestation of immense merits, by pure intellect, with intense detachment and in the company of the enlightened one. This human birth is the only opportunity to understand that. That too is seized by the fear of uncertainty; there, indolence (idleness) is occurring, it is a pity and a surprise.
Aum

પત્રાંક - ૮૧૬



મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪

તમારા લખેલા કાગળો મળ્યા છે.

અમુક સદ્ગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે.

મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે.

કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ઝૂં



શ્રીમદ્ રાજયંદ્ર મિશન
ધરમપુર